



નવસર્જન

ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.



PROUDLY
CO-OPERATIVE

પચીસમો વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૦૨૧



પ્લોટ નં. ૫૬૦૨, સી/૧, સી/૧૪, નવસર્જન સર્કલ, જી.આઈ.ડી.સી., અંકલેશ્વર-૩૬૩ ૦૦૨.

ફોન નં. (૦૨૬૪૬) ૨૨૩૭૯૯, ૨૫૨૭૯૧, ફેક્સ : ૨૫૨૦૯૯ E-mail ID : nicbltd@gmail.com

“સૌનો સહકાર સર્વાંગી વિકાસ”





નવસર્જન

ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

બેંકની પ્રગતિ દર્શક આંકડાકીય માહિતી (રૂ.લાખમાં)

વિગત	૩૧.૦૩.૨૦૧૫	૩૧.૦૩.૨૦૧૬	૩૧.૦૩.૨૦૧૭	૩૧.૦૩.૨૦૧૮	૩૧.૦૩.૨૦૧૯	૩૧.૦૩.૨૦૨૦	૩૧.૦૩.૨૦૨૧
શેર ભંડોળ	૧૩૬.૮૦	૧૩૪.૫૦	૧૨૩.૦૯	૧૨૭.૦૫	૧૨૮.૩૬	૧૩૩.૬૭	૧૩૬.૦૯
થાપણો	૪૨૮૨.૫૬	૪૩૭૦.૨૫	૫૧૭૭.૭૫	૫૦૨૪.૨૬	૫૧૯૫.૫૧	૫૭૬૮.૧૧	૬૨૬૩.૯૦
ધિરાણ	૧૭૧૬.૪૦	૨૦૭૦.૮૨	૧૯૧૩.૩૯	૨૨૧૯.૫૪	૨૬૨૧.૪૦	૩૧૩૭.૨૭	૩૫૨૫.૧૧
ચીઝર્વ / અન્ય ફંડ	૬૭૪.૮૯	૭૯૫.૦૨	૮૯૨.૬૫	૯૭૯.૨૨	૧૦૮૭.૦૨	૧૨૦૨.૮૩	૧૩૨૯.૨૮
કામકાજનું ભંડોળ	૫૪૩૦.૧૫	૫૬૯૫.૩૨	૬૪૮૪.૯૬	૬૪૬૯.૭૯	૬૭૩૩.૫૪	૭૪૩૮.૩૦	૮૧૨૨.૨૨
સભાસદ સંખ્યા	૫૭૧૨	૫૮૫૧	૫૭૫૧	૬૧૪૫	૬૪૧૫	૬૬૩૦	૬૭૭૨
ઓડીટ વર્ગ	‘અ’	‘અ’	‘અ’	‘અ’	‘અ’	‘અ’	‘અ’
નફો (કરવેરા અને જોગવાઈઓ પહેલા)	૨૦૨.૨૩	૧૮૫.૨૪	૧૫૦.૫૩	૧૯૩.૭૧	૨૦૬.૯૨	૨૧૦.૯૭	૨૨૩.૧૫
ડિવિડન્ડ	૧૨%	૧૨%	૧૦%	૧૨%	૧૨%	---	૧૦% સુચિત



**HOUSING
LOAN SCHEME**



**BUSINESS
LOAN SCHEME**



**VEHICLE
LOAN SCHEME**



**GOLD
LOAN SCHEME**



**RUPAY
Debit Card**



**Mobile
Banking**

- **KNOW YOUR ACCOUNT BALANCE JUST A MISSED CALL : 08046878341**
- **GET SMS ALERTS AND UPDATE YOUR EVERY TRANSACTION OF ACCOUNT**
- **RTGS / NEFT / IMPS / SMS ALERT / RUPAY DEBIT CARD / MOBILE BANKING**



નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

બેંકની વિવિધ કમિટીઓ

* ધિરાણ કમિટી :-

શ્રી રજનીકાત એમ. પટેલ
શ્રી જતીનભાઈ જે.શાહ
શ્રી ભુપેન્દ્રભાઈ બી. પટેલ
શ્રી કિરીટભાઈ જે. પટેલ
શ્રી દિલીપભાઈ એન. પટેલ
શ્રી જસુભાઈ એસ ચૌધરી
શ્રી વિમલભાઈ આર જેઠવા

*ઓડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કમિટી :-

શ્રી રજનીકાત એમ. પટેલ
શ્રી મનિષભાઈ કે. પટેલ
શ્રી ભુપેન્દ્રભાઈ બી. પટેલ
શ્રીમતિ સીમાબેન જી. શુક્લા
શ્રી વિમલભાઈ આર જેઠવા
શ્રી મહેશકુમાર એ. મહેતા

*બેંક વિકાસ અને maintenance કમિટી:-

શ્રી પારસભાઈ પી. પટેલ
શ્રી મનિષભાઈ કે. પટેલ
શ્રી ભુપેન્દ્રભાઈ બી. પટેલ
શ્રી કિરીટભાઈ જે. પટેલ
શ્રી સોમાભાઈ કે.આહીર
શ્રી સોમાભાઈ એ. વસાવા
શ્રી વિમલભાઈ આર જેઠવા

* રીકવરી કમિટી :-

શ્રી પારસભાઈ પી. પટેલ
શ્રી જતીનભાઈ જે.શાહ
શ્રી કિરીટભાઈ જે. પટેલ
શ્રી હર્ષદભાઈ કે.શાહ
શ્રી જસુભાઈ એસ ચૌધરી
શ્રી બલદેવભાઈ એસ આહિર

*ગ્રીફ્ટ કમિટી :-

શ્રી પારસભાઈ પી. પટેલ
શ્રી કિરીટભાઈ જે. પટેલ
શ્રી દિલીપભાઈ એન. પટેલ
શ્રીમતિ સીમાબેન જી. શુક્લા
શ્રીમતિ વર્ષાબેન જે. દલાલ
શ્રી સોમાભાઈ એ. વસાવા
શ્રી જસુભાઈ એસ ચૌધરી
શ્રી બલદેવભાઈ એસ આહિર

*આઈ.ટી. કમિટી :-

શ્રી રજનીકાત એમ. પટેલ
શ્રી જતીનભાઈ જે.શાહ
શ્રી ભુપેન્દ્રભાઈ બી. પટેલ
શ્રી દિલીપભાઈ એન. પટેલ
શ્રી મહેશકુમાર એ. મહેતા

HR કમિટી (Customer Care, Staff discipline)

શ્રી પારસભાઈ પી. પટેલ
શ્રી મનિષભાઈ કે. પટેલ
શ્રી સોમાભાઈ કે.આહીર

શ્રી હર્ષદભાઈ કે.શાહ
શ્રી સોમાભાઈ એ. વસાવા
શ્રી બલદેવભાઈ એસ આહિર



નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ



શ્રી રજનીકાંત એમ. પટેલ
ચેરમેન -૯૮૨૪૧ ૪૭૧૧૬



શ્રી પારસભાઈ પી. પટેલ
વા. ચેરમેન -૯૭૧૨૧ ૩૩૧૧૧



શ્રી મનિષભાઈ કે. પટેલ
મે. ડિરેક્ટર -૯૮૨૪૫ ૩૩૫૬૬



શ્રી જતીનભાઈ જે. શાહ
ડિરેક્ટર -૯૮૨૪૧ ૮૨૭૪૫



શ્રી ભુપેન્દ્રભાઈ બી. પટેલ
ડિરેક્ટર -૯૮૨૪૪ ૭૬૪૨૬



શ્રી કીરીટભાઈ જે. પટેલ
ડિરેક્ટર -૯૮૨૫૦ ૩૮૪૨૬



શ્રી સોમાભાઈ કે. આહીર
ડિરેક્ટર -૯૪૨૭૧ ૧૦૦૫૭



શ્રી દિલીપભાઈ એન. પટેલ
ડિરેક્ટર -૯૮૨૪૧ ૦૬૦૦૧



શ્રી હર્ષદભાઈ કે. શાહ.
ડિરેક્ટર -૯૮૨૪૧ ૫૦૫૯૪



શ્રીમતિ સીમાબેન જી. શુક્લા
ડિરેક્ટર -૮૧૨૮૬ ૬૦૪૪૮



શ્રીમતિ વર્ષાબેન જે. દલાલ
ડિરેક્ટર -૯૮૨૪૧ ૭૯૨૯૮



શ્રી સોમાભાઈ એ. વસાવા
ડિરેક્ટર -૯૨૨૮૧ ૩૮૦૨૩



શ્રી નલદેવભાઈ એસ. આહીર
ડિરેક્ટર -૯૮૨૫૩ ૨૭૨૨૪



શ્રી વિમલભાઈ આર. જેઠવા
ડિરેક્ટર -૯૮૨૪૧ ૨૧૭૧૫



શ્રી જયુભાઈ એસ. ચૌધરી
ડિરેક્ટર -૯૮૨૪૪ ૭૬૧૧૮



શ્રી મહેશભાઈ એ. મહેતા
કો-ઓપ્ટ પ્રોફેશનલ ડિરેક્ટર
-૯૮૭૯૧ ૧૮૭૬૭

નવસર્જન બેંક ટીમ



મયુર બી. પટેલ
મેનેજર
મો. ૮૮૬૬૪ ૭૬૪૨૬



સંજય આઈ. ઉપાધ્યાય
આસિ. મેનેજર
મો. ૯૮૯૮૦ ૦૫૨૯૦



ભરત એન. પટેલ
સિ. ઓફીસર
મો. ૯૮૨૪૩ ૧૩૪૪૪



વિપુલ આર. પટેલ
ઓફીસર
મો. ૯૮૨૪૫ ૧૧૩૧૭



KNOW YOUR BANK

Bank Name	: Navsarjan Industrial Co-op. Bank Ltd.
Registered Office Address	: Plot No 5602, C/1 & C/14, Navsarjan Circle, GIDC, Ankleshwar- 393 002.
Phone No.	: 02646 223799, 252791
Fax	: 02646 252099
E-Mail Id	: info@navsarjanbank.com
Website	: www.navsarjanbank.com
Bank Opening Day	: Dt. : 29-01-1997
Bank Code & Alpha Code	: 393 802 MNB
MICR Code	: 393 802 051
RBI Licence No.	: UBD/GUJ/1303 P Dt.24/10/1996
Regi No.	: SA 27992 Dt:01/08/1996
PAN No.	: AAAAN0531E
GST No.	: 24AAAAA0531E1ZB
OSS Code	: 08678601
TAN No	: BRDN00394C
DICGC Code & No.	: UCCBGJ00172 / 86786
IFSC Code	: HDFC0CNICBL

OFFICE BARRERS

Chairman	: Shri Rajnikant M. Patel
Vice Chairman	: Shri Parasbhai P. Patel
Managing Director	: Shri Manishbhai K. Patel
Manager	: Shri Mayur B Patel

Balance Enquire No. : 08046878341



નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.



**Annual
Report-2021**

(૧) બચતખાતાં	૩.૦૦%	(૧) કેશ ક્રેડીટ, HYP, HYP.MC ., OD	૮.૪૦%
(૨) બાંધી મુદતની થાપણ		(૨) વાહન લોન ધિરાણ	
૩૧ દિવસથી ૯૦ દિવસ સુધી	૪.૦૦%	-મોટરકાર	૭.૫૦%
૯૧ દિવસથી ૧૮૦ દિવસ	૪.૫૦%	-ટુ-વ્હીલર (સ્કુટર, મોટરબાઈક વિ)	૧૦.૦૦%
૧૮૧ દિવસથી ૧ વર્ષની અંદર	૪.૮૦%	-ટ્રક-ટેન્કર અચ.એમ.વી.(કોમર્શીયલ વાહન)	૮.૫૦%
૧ વર્ષથી ૨ વર્ષની અંદર	૫.૩૦%	-ચાર વર્ષથી વધુ જૂનું ના હોય તેવું વાહન	૧૩.૦૦%
૨ થી ૩ વર્ષની અંદર	૫.૨૦%	(૩) હાઉસિંગ લોન	૭.૬૦%
૩ વર્ષ થી વધુ	૫.૧૦%	(૪) પ્રોપર્ટી મોર્ગેજ લોન	૮.૮૦%
		(૫) એન.એસ.સી./કે.વી.પી.	૧૧.૦૦%
બાંધી મુદતની થાપણની ઉપરોક્ત દરેક યોજનામાં		(૬) Gold Loan (દાગીના સામે)	૧૧.૦૦%
સીનીયર સીટીઝનને ૦.૫૦% વધુ વ્યાજ મળશે.		(૭) Education Loan	૮.૫૦%
		(૮) ફીક્સ ડીપોઝીટ સામે ધિરાણ -	ડિપોઝીટ રેટ
			+૧% વધારે

આપણી બેંક દ્વારા નીચેની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

- * બેંકીંગને લગતું કામકાજ કરે છે.
- * ગુજરાત તથા દેશભરના તમામ સ્થળો ઉપર ચેક્સ તથા ડ્રાફ્ટસ, રસીદો, હુંડીઓની વસુલાત ફક્ત પોસ્ટેલ ચાર્જ લઈ કરી આપવામાં આવે છે.
- * વિમા યોજના હેઠળ આપની ડિપોઝીટ રૂ.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ સુધીની) સુરક્ષિત અને સલામત છે.
- * બેંકના ખાતેદારોને બહાર ગામના **payable at par cheque** તેમજ બેંકર્સ ચેક મફતમાં કાઢી અપવામાં આવે છે.
- * ઇન્કમેટેક્સના કાયદા હેઠળ વાર્ષિક રૂ.૪૦,૦૦૦/- સુધીના (સીનીયર સીટીઝનના કિસ્સામાં રૂ.૫૦,૦૦૦/-) વ્યાજની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. તેથી વધારે વ્યાજ મેળવતા ખાતેદારોએ **15G / 15H** જે લાગુ પડતું હોય તે બેંકમાં સમયસર રજુ કરવાનું રહેશે.
- * સેઈફ ડીપોઝીટ વોલ્ટની વ્યવસ્થા છે.
- * બેંક ગુજરાત ગેસના તમામ પ્રકારના બીલો, ડી.જી.વી.સી.એલ. ના જી.આઈ.ડી.સીના રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ લાઈટબીલ અને જી.આઈ.ડી.સી. ની શ્રી ગૃહ વિધાલય તથા લાયન્સ સ્કુલ ની ફીનાં નાંણા સ્વીકારે છે.
- * સરળ ઝડપી અને સ્પર્ધાત્મક દરોએ લોન સુવિધા.
- * ઝડપી કામકાજ, વિનયી સ્ટાફ દ્વારા ઉમદા સેવા.
- * **RTGS/NEFT** થી ઇન્ડ ટ્રાન્સફર, **Mobile Banking** દ્વારા **IMPS Facility** થી ત્વરિત **fund transfer** કરવાની સુવિધા છે. તેમજ **Rupay Debit Card** દ્વારા **P.O.S** અને **E.Com** જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

બેંકના કામકાજનો સમય :

સોમવારથી શનિવાર : સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ સુધી
દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બહેર રજા રહેશે.



વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી બેંકના સર્વે સભાસદશ્રીઓને જણાવવાનું કે બેંકની પચ્ચીસમી વાર્ષિક સાધારણ સભા તા.૦૩/૦૮/૨૦૨૧ને શુક્રવારના રોજ ૩:૩૦ કલાકે નવસર્જન બેંકના સભાખંડમાં પ્લોટ નં.-૫૬૦૨, સી-૧, સી-૧૪, જી.આઈ.ડી.સી. એસ્ટેટ અંકલેશ્વરના સ્થળે નીચે જણાવેલ કાર્યસૂચિ મુજબના કામકાજ માટે મળશે તો સર્વે સભાસદશ્રીઓને સમયસર હાજરી આપવા વિનંતી છે.

કાર્યસૂચિ

- (૧) તા. ૨૯/૦૧/૨૦૨૧ ની સાધારણ સભાની કાર્યવાહી વાંચનમાં લઈ બહાલી આપવા બાબત.
- (૨) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી રજુ થયેલ અહેવાલ તથા ઓડિટરશ્રી તરફથી પ્રમાણિત થયેલ તા.૩૧.૦૩.૨૦૨૧ના રોજ પુરા થતા નાણાકીય વર્ષના ઓડિટ થયેલ નફા-નુકશાનના હિસાબો તથા પાકુ સરવૈયુ, ઓડીટ રીપોર્ટ સાથે વાંચનમાં લઈ મંજૂર રાખવા બાબત.
- (૩) સને ૨૦૨૦-૨૧ ના વર્ષના નફાની ફાળવણી મંજૂર કરવા બાબત.
- (૪) આંતરીક ઓડિટરશ્રીની નિમણૂકને બહાલી આપવા બાબત.
- (૫) સને ૨૦૨૧-૨૨ના વર્ષ માટે રીઝર્વ બેંક નક્કી કરે તે સહકાર ખાતાના પેનલ ઉપરના પ્રમાણિત ઓડિટરશ્રીની નિમણૂકને બહાલી આપવા બાબત.
- (૬) ચેરમેનશ્રીની પૂર્વ મંજૂરી લઈ નિયમાનુસાર જે કંઈ કામ રજુ થાય તેની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવા બાબત.
- (૭) આભાર વિધિ.

સ્થળ : અંકલેશ્વર

તારીખ: ૧૬/૦૮/૨૦૨૧.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી,

**મયુર બી. પટેલ
મેનેજર**

- નોંધ: (૧) કોરમના અભાવે મીટીંગ મુલતવી રહેશે તો તે જ દિવસે ૩૦ મિનિટ બાદ તે જ સ્થળે હાજર રહેલા સભ્યોનાં કોરમથી સભાનું ઉપર મુજબનું કામ શરૂ કરવામાં આવશે.
- (૨) સભામાં ઉપસ્થિત રહેનાર સભાસદે હાજરીની સહી કરવાની રહેશે.
 - (૩) સભાસદોએ જે કંઈ ખુલાસા મેળવવા હોય તે સંબંધે લેખીત જાણ સભાની તારીખ ના સાત દિવસ પહેલા કરવી. સમયસર આવેલ પત્રની સભામાં પ્રમુખશ્રીની મંજૂરીથી સમજૂતી આપવામાં આવશે.
 - (૪) બેંકના પેટા કાયદા અનુસાર તથા ભારતના બંધારણમાં થયેલા ૯૭ મા સુધારા અનુસાર બેંકના દરેક સભાસદે બેંકની કોઈપણ એક સેવા લેવી ફરજિયાત હોવાથી બેંકના દરેક સભાસદ / સભાસદ પેટીઓને વિનંતી છે કે તેઓ આપણી બેંકમાં બચત / ચાલુખાતુ ખોલાવે, જેથી તેમને ચૂકવવા પાત્ર ડિવિડન્ડની રકમ ખાતામાં જમા કરવામાં સુગમતા રહે.



ચેરમેનશ્રીનું નિવેદન

માનનીય સભાસદ ભાઈઓ અને બહેનો,

બેંકની **પચ્ચીસમી વાર્ષિક સાધારણ** સભામાં આપ સર્વેને આવકારતા હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરું છું.

અનેક પડકારો અને ધીમી આર્થિક ગતિવિધીઓ વચ્ચે પણ આપણી નવસર્જન બેંક તેના વિકાસલક્ષી કામગીરીનાં ચોવીસવર્ષ પુરા કરી પચ્ચીસમાં વર્ષમાં મંગલ પ્રસ્થાન કરે છે, ત્યારે આપ સર્વેને બિરદાવતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. બેંક મક્કમ દૃઢતાપૂર્વક આગળ વધતી જાય છે આ સતત પ્રગતિ અને સિદ્ધિ આપ સૌના સાથ સહકાર વિના સંભવિત નથી. સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન મળે તેવા પ્રયત્નો પણ બેંક તરફથી હાથ ધરવામાં આવે છે.

બેંકના સને ૨૦૨૦-૨૦૨૧ના નાણાકીય વર્ષના ઓડિટ થયેલ હિસાબો, સરપૈયુ તથા નફા-નુકશાનનું ખાતું સાથે ઓડીટરરીપોર્ટ સર્વેને બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા મંજૂર કરેલ છે, જે આપ સૌ સમક્ષ રજૂ કરતાં ગૌરવની લાગણી અનુભવું છું. આપ સૌ તેને માન્યતા આપશો એવી આશા રાખું છું.

સભાસદો અને શેર ભંડોળ :-

તા.૩૧-૦૩-૨૦૨૧ ના રોજ પૂરા થતા વર્ષના અંતે બેંકના સભાસદોની સંખ્યા ૬૭૭૨ થવા પામેલ છે. તા:૩૧.૦૩.૨૦૨૦ના રોજનું શેરભંડોળ રૂ.૧,૩૩,૬૭,૧૨૫.૦૦ હતું. જેમાં રૂ.૨,૪૨,૩૫૦.૦૦નો વધારો થયેલ છે વર્ષના અંતે તા.૩૧-૦૩-૨૦૨૧ના રોજ બેંકનું શેરભંડોળ રૂ.૧,૩૬,૦૯,૪૭૫.૦૦ જેટલું થવા પામેલ છે.

ડીપોઝીટ :-

બેંકીંગ સેવાઓની હરીફાઈના સમયમા સહકારી બેંકોએ અનેક મુશ્કેલીઓ તેમજ સંઘર્ષમય વાતાવરણ વચ્ચે થાપણો મેળવવી અને તેને જાળવી રાખવી જેનો આધાર બેંકની નાણાકીય સધ્ધરતા અને ગ્રાહકોને મળતી ઝડપી અને ઉમદા સેવાઓ તથા તેઓના વિશ્વાસ ઉપર નિર્ભર છે. થાપણો બેંકની પ્રગતિનો આધાર સ્તંભ છે અને સિદ્ધિઓ બેંકનો અરીસો છે.

તા.૩૧-૦૩-૨૦૨૦ના રોજ બેંકની કુલ થાપણો રૂ.૫૭,૬૮,૧૦,૭૫૫.૦૦ હતી. જેમાં ઉત્તરોત્તર રૂ.૪,૯૫,૭૯,૩૪૨.૦૦ નોવધારો થવાથી તા.૩૧-૦૩-૨૧નાં રોજ રૂ.૬૨,૬૩,૯૦,૦૯૭.૦૦ થયેલ છે જે આપ સૌએ તથા થાપણદારોએ બેંક પ્રત્યે દાખવેલ અતુટ વિશ્વાસ અને સહકારનું જ પરીણામ છે જેના અમો ખૂબ ખૂબ આભારી છીએ.



ડીપોઝીટ ઇન્સ્યોરન્સ :-

બેંકે થાપણદારોના હિતમાં તેઓની સુરક્ષા જળવાઈ રહે અને સહી સલામત રહે એવા શુભ આશયથી ડીપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂ.૫,૦૦,૦૦૦/- ની વ્યક્તિગત થાપણોનો વિમો લઈ સુરક્ષા કવચ હેઠળ સુરક્ષિત અને સલામતી પુરી પાડેલ છે. અને તે માટે ભરવા પડતા પ્રીમીયમ પણ નિયમિત સમયસર ભરી દેવાની કાળજી લેવામાં આવે છે. ચાલુ સાલનું પ્રીમીયમ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીનું એડવાન્સમાં ભરેલ છે.

ધિરાણ :-

બેંકનું ભંડોળ મહદઅંશે થાપણો દ્વારા એકત્રિત થયેલ છે જેનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વખતોવખતના આદેશ અનુસાર મર્યાદામાં રહીને મધ્યમવર્ગના ખાતેદારોની, નાના ઉદ્યોગકારોની ધિરાણ માંગણીઓ સંતોષવા સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. પ્રવર્તમાન સમય આર્થિક મંદીનો હોવા છતાં પણ કરજદારોને ઝડપી નાણાંકીય સુવિધા લઈ જામીનદારોની ખાતરી કર્યા બાદ વધુનેવધુ લાભ આપી શકાય તે દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી બેંકના સંચાલક મંડળે વ્યક્તિઓને પોતાનું મકાન/ફ્લેટ વસાવવા, નાના વેપારીઓ, છુટક ધંધો કરતા સ્વ-રોજગારવાળા વ્યક્તિઓ, ટ્રાન્સપોર્ટરોને ધિરાણની સગવડતા આપી મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. તા.૩૧-૦૩-૨૦૨૦ના રોજ કુલ ધિરાણ રૂ.૩૧,૩૭,૨૬,૬૯૯.૦૦ હતું. જેમાં વર્ષ દરમિયાન રૂ.૩,૮૭,૮૪,૩૬૮.૦૦ લાખનો વધારો થતા તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ કુલ ધિરાણ રૂ.૩૫,૨૫,૧૧,૦૬૭.૦૦ થયેલ છે.

ડિવિડન્ડ :-

બેંકના કામકાજમાં તેની નફા-કારકતા કરતા સેવાનો હેતુ વિશેષ રહેલ છે. જેથી કાયદાકીય જોગવાઈમાં રહીને સભાસદોને આપી શકાતા ડિવિડન્ડની મર્યાદા અનુસાર ચાલુ વર્ષે બોર્ડ ઓફ ડીરેક્ટર્સે તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી ભરાયેલા તથા વસુલ આવેલ શેરભંડોળ ઉપર ૧૦% ડિવિડન્ડની ભલામણ કરી છે. જેને આપ સૌ બહાલી આપશો.



નફાની વહેંચણી :-

બેંકની કાર્યક્ષમતા અને નફાકારકતા કોઈપણ સાહસની પ્રગતિની પાયાશીશી છે. બેંક પોતાની નફાકારકતામાં ખુબ જ આવકાર્ય અને સંગીનતા પ્રાપ્ત કરી જરૂરી એવી જોગવાઈઓ કરતાં બેંકના પેટાકાયદાની જોગવાઈઓ તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમો મુજબ આવક માન્યતા અસેટ્સની જોગવાઈઓ કરવાની થતી હોય તેમજ દુખત અને શંકમંદ લેણાંની જોગવાઈ કરતા તથા જરૂરી વહીવટી ખર્ચા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જોગવાઈ બાદ કરતાં ચોખ્ખો નફો રૂ. ૧,૫૮,૬૪,૬૫૯.૦૯નો કરેલ છે, જેને બેંકના પેટા-નિયમ અનુસાર અને રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, ગાંધીનગર દ્વારા બહારપાડેલ આદેશ અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓએ નીચે મુજબની ફાળવણી કરેલ છે. જેને આપ સૌને મંજૂર રાખવા ભલામણ કરેલ છે

ચાલુ સાલના સરવૈયા મુજબના ચોખ્ખા નફાની રૂ. ૧,૫૮,૬૪,૬૫૯.૦૯ ફાળવણી નીચે મુજબ છે.

અ.નં.	વિગત	ટકા (%)	ફાળવણી કરેલ રૂ. પૈસા.
૧	રીઝર્વ ફંડ	૫૦%	૭૯,૩૨,૩૨૯.૦૦
૨	શંકમંદ લેણાંફંડ	૧૫%	૨૩,૭૯,૬૯૯.૦૦
૩	ધર્માદા ફંડ	૧%	૧,૫૮,૬૪૬.૦૦
૪	ડિવિડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ	૨%	૩,૧૭,૨૯૩.૦૦
૫	શિક્ષણ ફંડ (૨% અથવા વધુમાં વધુ રૂ. ૦૦ લાખ)	૨%	૨,૦૦,૦૦૦.૦૦
૬	સહકાર પ્રચાર ફંડ	૨.૫૦%	૩,૯૬,૬૧૬.૦૦
૭	ડિવિડન્ડ (ભરાયેલ શેર મુડીના ૧૦% સુચીત)		૧૨,૮૩,૨૨૪.૦૦
૮	સભાસદ પ્રોત્સાહન ફંડ (૧૦% અને બાકી રહેલ નફાની રકમ)		૩૧,૯૬,૮૫૨.૦૯
		કુલ નફો	૧,૫૮,૬૪,૬૫૯.૦૯

ઓડીટ :-

અહેવાલના વર્ષનું ઓડીટ રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નિયુક્ત કરાયેલ **HIRAL PRAJAPATI & CO.,** ચાર્ટડ એકાઉન્ટન્ટ, સહકારી મંડળીઓ, આણંદ, પેનલ-૩૦૮ દ્વારા થયેલ છે. તેઓએ ઝીણવટ ભરેલ ઓડીટ દરમિયાન બેંકની કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ હતો, તેઓશ્રીએ બેંકના વિકાસ અને કામકાજ અંગે સલાહ-સૂચન અને માર્ગદર્શન આપી ઓડીટ વર્ગ 'અ' ચાલુ રાખેલ છે.

સેફ ડિપોઝીટ લોકર :-

બેંકે પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ નાગરિકોના તથા ગ્રાહકોના દાગીના, જરૂર-ઝવેરાત તથા કિંમતી કાગળો સલામત અને સુરક્ષિત રહે તેવી સગવડ પુરી પાડવાના શુભ આશયથી ગોદરેજ કું. ના ૧૪૬૧ સેફ ડિપોઝીટ લોકર વસાવેલ છે. જેનો મહત્તમ ઉપયોગ ખાતેદારો-સભાસદો દ્વારા કરવામાં આવે છે તે જાણી આનંદની લાગણી અનુભવું છું.



નોન પરફોર્મિંગ એસેટ્સ :-

ફાયનાન્સ ક્ષેત્રે કામ કરતી કોઈપણ સંસ્થાના આર્થિક વહીવટ પરિસ્થિતિનું માપદંડ **NPA** છે. બેંકિંગ ક્ષેત્રે ધિરાણ રીકવરીના ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે વર્ષ ૨૦૦૩થી સતત સોળમા વર્ષે પણ બેંકનું ગ્રોસ **NPA** રૂ.૩૦.૨૭ લાખ છે. જે કુલ ધિરાણના ફક્ત ૦.૮૬% છે અને તેની સામે બેંકે નફાની ફાળવણીમાંથી રૂ.૨૬૭.૮૩ લાખની જોગવાઈ કરેલ છે અને આપ સૌ સભાસદોને ગર્વપૂર્વક જણાવું કે તા:૩૧/૦૩/૨૦૨૧ રોજ બેંકનું નેટ **NPA** ૦% છે. કરજદાર સભાસદો તથા તેમના જામીનો વસુલાત આપવા બાબતે સજાગ નહીં થાય અને ધિરાણ સમયસર ભરપાઈ નહીં કરી જાય તો બેંકે નઘૂટકે તેઓની તથા તેઓના જામીનદારોની મિલ્કતો ટાંચમાં લઈ હરાજીની પ્રક્રિયા કરી વસૂલ કરી લેવા પણ અચકાશે નહીં જેની કરજદાર તથા જામીનદાર સભાસદો નોંધ લે તેવી વિનંતી.

ગ્રાહક સેવા :-

બેંકીંગ સેવાનો મુખ્ય આધાર કર્મચારીઓના ઉત્સાહ સજ્જતા, ખંત અને અભીગમ ઉપર હોય છે. બેંક પોતાના આગવા સુત્ર **"SMILE AND GROW WITH YOUR BANK"** ને ધ્યાનમાં રાખી ઝડપી અને ઉમદા સેવા આપવા નમ્ર પ્રયત્ન કરે છે. બેંક જી.આઈ.ડી.સી. ના એરિયામાં આવેલી સ્કુલોની ફી, તથા ગુજરાત ગેસના બીલ તથા ડી.જી.વી.સી.એલ. ના બીલ કલેક્શનની કામગીરી પણ કરે છે. ઉપરાંત ફેક્ટરીના કર્મચારીઓ અને સ્કુલના શિક્ષકો વગેરેનો પગાર પણ બેંક દ્વારા કરવામાં આવે છે. જે બેંકની આગવી ઓળખ છે.

કોર બેંકીંગ સોલ્યુશન તથા ડીજિટલ સેવાઓ :-

બેંકના ગ્રાહકોને ઝડપી તેમજ વધુ સારી સવલત મળી રહે તે હેતુથી બેંકે માર્ચ '૧૮ થી નવું **CBS Banking Software** વસાવેલ છે જેમાં **SMS** એલર્ટ તથા ખાતામાં નોંધાવેલ રજીસ્ટર્ડ મોબાઈલ દ્વારા ૦૮૦૪૬૮૭૮૩૪૧ નંબર ઉપર **missed call** આપવાથી ખાતાનું **Balance** જાણી શકાય તેવી સુવિધા આપવામાં આવે છે તથા રજીસ્ટર્ડ **Email ID** ઉપર ખાતાનું સ્ટેટમેન્ટ મેળવી શકાશે. **RTGS/NEFT** તથા **Mobile Banking** દ્વારા **IMPS facility** થી ત્વરિત **fund transfer** કરવાની સુવિધા બેંક દ્વારા પુરી પાડવામાં આવે છે. તેમજ **Rupay Debit Card** દ્વારા **P.O.S** અને **E.Com** જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

સામાજિક જવાબદારી :-

ચાલુ વર્ષનાં કોરોનાની મહામારીના સમયમાં આપણી બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણા વિસ્તારના જરૂરિયાતમંદ વ્યક્તિઓને ફુડ પેકેટ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે.



શ્રદ્ધા સ્વીકાર :-

છેલ્લા ચોવીસ વર્ષથી સર્વ સભાસદો અને ખાતેદારોનો પુરા વિશ્વાસ સાથે સાથ સહકાર મળ્યો છે. થાપણદારોના અતૂટ વિશ્વાસ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બેંકના વિકાસ માટે વિવિધ કમિટીના સભ્યો પ્રત્યે પણ આભાર પ્રગટ કરીએ છીએ. બેંકના કાર્યમાં હંમેશા સહકાર અને માર્ગદર્શન આપવા બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તથા ભરૂચ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર તેમજ ગુજરાતના સહકારી વિભાગ તેમજ અન્ય બેંકોના પદાધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. કોરોનાની મહામારી રૂપી મુશ્કેલીઓ અને મુંઝવણોના સમયવર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જે કોઈ તરફથી મળેલ પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર બદલ બેંક વતી તે સર્વેનું શ્રદ્ધા સ્વીકાર કરું છું.

અંતમાં અમારામાં મુકેલ વિશ્વાસનો અમો ખૂબ ઉંચી સેવાઓ આપી બેંકનો ઝડપી વિકાસ કરવા તમામ પ્રયત્ન કરશું તથા આપે કરેલા રોકાણોનું મહત્તમ વળતર મળે તેવા પ્રયત્નો કરશું.

રજનીકાંત એમ પટેલ ચેરમેન

તમારા ગ્રાહકને ઓળખો Know your customers ના નિયમનું પાલન

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ બેંકના ગ્રાહકોની ઓળખનીતિ ફરજિયાત બનાવતા બચત/કરંટ/લોકર્સ/એફ.ડી./શેરના ખાતેદારોને અંતર્ગત નીચે જણાવેલ દસ્તાવેજ પુરાવા બેંકમાં રજુ કરી KYCની પુર્તતા કરવાની રહેશે.

૧. પાસપોર્ટ સાઈઝના બે તાજેતરના કલર ફોટોગ્રાફ

૨. ઓળખાણ માટે નીચેના માંથી કોઈપણ એક પુરાવાની નકલ

- (૧) ભારત સરકારનું પાનકાર્ડ (૨) ભારત સરકારનું ચુંટણી કાર્ડ (૩) આધાર કાર્ડ
(૪) પાસપોર્ટ (૫) ડ્રાઈવીંગ લાઈસન્સ

૩. સરનામા પુરાવા માટે નીચેનામાંથી કોઈપણ એક પુરાવાની નકલ

- (૧) ટેલીફોન બીલ (૨) લાઈટબીલ (૩) રેશનકાર્ડ (૪) આધાર કાર્ડ
(૫) ભાડે રહેતા હોય તો ભાડા કરાર (૬) બેંક એકાઉન્ટની પાસબુકની નકલ
(૭) ગર્વ. ડીપાર્ટમેન્ટમાંથી ઈસ્યુ કરેલ પત્રની નકલ

૪. કરંટ ખાતુ ખોલાવવા માટે પાનકાર્ડની નકલ ફરજિયાત આપવી પડશે. બચત ખાતા માટે પાનકાર્ડ અથવા ફોર્મ -૬૦ આપવાનું રહેશે.

ઉપરોક્ત મુજબના તમામ દસ્તાવેજો જે ખાતેદારો રજુ ન કર્યા હોય તેઓએ તાત્કાલિક રજુ કરી દેવા નહીં તો રીઝર્વ બેંકના નિયમ મુજબ ખાતામાં લેવડ-દેવશ બંધ કરી દેવામાં આવશે.



આભાર વિધિ :-

આપ સૌ સભાસદોએ અમારામાં અટલ વિશ્વાસ મૂકી અમને જે જવાબદારી સોંપી છે, તે માટે તમામ સભાસદ ભાઈઓ અને બહેનોનો અમો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સભાસદો થાપણદારો અને ગ્રાહકોએ ઉષ્માભર્યો સાથ-સહકાર આપી બેંકની વિકાસની ગતિને વેગ આપેલ છે, તે બદલ તેઓ સર્વેના પણ આભારી છીએ.

બેંકના રોજબરોજના વહીવટ અને નિતી વિષયક કાર્યો સુલભ બનાવવા સેવાકીય રચનાત્મક સહકાર આપવાબદલ આપણી બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓએ તેમના કિંમતી સમયનો ભોગ આપી જે કાર્યદક્ષતા બતાવી છે અને બેંકના વિકાસમાં કીમતી ફાળો બદ્યો છે તે બદલ તેઓના પણ ખૂબ જ આભારી છીએ.

બેંકના કાર્યને ગતિશીલ રાખવા બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, કર્મચારી ભાઈ-બહેનોએ ઉડો રસ લઈ જે તનતોડ મહેનત કરી છે તેવી કાર્યપદ્ધતિ ચાલુ રાખી, જીલ્લાની બેંકોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે તે કાયમ રહે તેવી અપેક્ષા રાખીએ છીએ. આપ સૌ કર્મચારીગણનો ઉત્સાહથી, અને ખંતથી અને ખેલદીલીપૂર્વક કામગીરી કરવા બદલ ધન્યવાદ.

બેંકનો ઝડપી વિકાસ થાય સાથે અવિરત પ્રગતિ ચાલુ રહે તે માટે જરૂરી સલાહ સુચનો માર્ગદર્શન આપવા બદલ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જીલ્લા સહકારી બેંકના પ્રમુખ/ મેનેજરશ્રી તથા સ્ટેચ્યુટરી ઓડિટરશ્રી **HIRAL PRAJAPATI & CO, C.A., Anand** તથા બેંકના **concurrent** ઓડિટરશ્રી કિશોરભાઈ એ. હરિયાણી (C.A.) નો ખુબ આભાર માનીએ છીએ.

જે સભાસદોને કરેલ ધિરાણની વસુલાત પણ સમયસર કરવી એ અનિવાર્ય છે. વર્ષ દરમિયાન બાકી લેણાં, ધિરાણ રકમના હપ્તા સમયસર પરત ના કરવાથી બેંકના નિયમોનુસાર નોટીસ આપવી પડી હોઈ થોડી સખતાઈ કરવી પડી હોય તો તે માટે અમો દિલગીર છીએ. આવા પ્રસંગ ન આવે તે માટે બેંકના નાણાં સમયસર પરત કરો તેવી કરજદાર સભાસદને અમો અપીલ કરીએ છીએ અને અંતમાં અમો અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે આપના ધંધા-રોજગારમાં પ્રગતિ થાય અને આપનું કૌટુંબીક જીવન આનંદમય બને એવી અમો આશા રાખીએ છીએ.

આપ સૌનો સાથ સહકાર અને સદ્ભાવ બેંકને મળેલ છે અને સતત મળતો રહે તેવી અભ્યર્થના સાથે વિરમું છું.

જય હિન્દ-જય ભારત

પારસભાઈ પી. પટેલ
વાઈસ ચેરમેન



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૦૩-૨૦૨૦ રકમ (રૂપિયા)	ખર્ચ	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૨,૩૯,૯૩,૨૩૪.૦૦ ૬૫,૩૭૬.૦૦	(૧) થાપણો ઉપરનું વ્યાજ કરજો ઉપરનું વ્યાજ		૨,૪૭,૮૫,૯૮૦.૦૦ ૦.૦૦
૭૫,૯૨,૩૪૦.૯૦	(૨) પગાર ભથ્થા, બોનસ અને પ્રોવિડન્ડ ફંડ		૮૬,૬૮,૯૮૯.૦૦
૨૫,૯૨,૨૩૦.૯૩	(૩) વહીવટી ખર્ચ (અ) ભાડુ-કરવેરા-વિજળી-વીમો રીપેરીંગ અને મેન્ટેનન્સ ખર્ચ વગેરે	૩૧,૩૪,૪૯૬.૩૩	
૯૫,૬૦૫.૦૨	(બ) તાર, ટપાલ અને ટેલીફોન તથા આંગડિયા ખર્ચ વગેરે	૮૭,૧૫૪.૨૨	
૩,૫૮,૧૭૫.૦૦	(ક) સિક્યુરીટી ચાર્જીસ	૩,૮૮,૨૯૮.૦૦	
૫૧,૮૨૬.૦૦	(ડ) ટ્રાવેલીંગ અને કન્વેયન્સ	૫૦,૩૭૩.૦૦	
૩૦,૯૭,૮૩૬.૯૫	(૪) સ્ટેશનરી પ્રિન્ટીંગ અને જાહેરાત ખર્ચ		૩૬,૬૦,૩૨૧.૫૫
૨,૬૬,૯૪૪.૪૪	(૫) ઓડિટ ફી		૨,૩૮,૩૮૭.૩૦
૧,૦૦,૦૦૦.૦૦	(૬) ઘસારા ખર્ચ		૯૩,૦૦૦.૦૦
૭,૮૯,૮૦૭.૦૦	(૭) અન્ય ખર્ચ		૫,૬૧,૩૦૩.૦૦
૯,૨૫,૨૪૩.૮૭	(૮) કમીશન અને ચાર્જીસ		૬,૪૨,૨૭૧.૫૦
૫૬,૮૨૯.૩૮	(૯) રોકાણોનું ઘસારા પ્રોવિઝન		૩૯,૭૦૨.૪૩
૦.૦૦	(૧૦) જોગવાઈઓ :-		૦.૦૦
૫,૦૦,૦૦૦.૦૦	(૧) લાંબાગાળાના દિરાણ સામે જોગવાઈ	૪,૫૦,૦૦૦.૦૦	
૫,૫૦,૦૦૦.૦૦	(૨) સ્ટાન્ડર્ડ એસેટ્સ લોન સામે જોગવાઈ	૪,૦૦,૦૦૦.૦૦	
૫,૦૦,૦૦૦.૦૦	(૩) રોકાણો સામે ઘસારાની જોગવાઈ	૫,૦૦,૦૦૦.૦૦	
૬૬,૦૦,૦૦૦.૦૦	(૪) ઈન્કમ ટેક્સની જોગવાઈ (૨૦૧૯-૨૦૨૦)	૫૧,૦૦,૦૦૦.૦૦	
૮૧,૫૦,૦૦૦.૦૦			૬૪,૫૦,૦૦૦.૦૦
૧,૨૯,૪૮,૧૮૨.૫૦	(૧૧) ચોખ્ખો નફો સરવૈયામાં લઈ ગયા તે		૧,૫૮,૬૪,૬૫૯.૦૯
૫,૭૯,૮૫,૭૯૫.૦૪	કુલ ટોટલ		૬,૧૦,૦૪,૬૧૩.૮૭

નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

અમારા ઓડિટ રીપોર્ટને આધિન

સ્થળ : અંકલેશ્વર

તારીખ : ૨૮/૦૬/૨૦૨૧

UDIN:21157524AAAABI2829

સહી :-

HIRAL PRAJAPATI & CO.

ચાર્ટડ એકાઉન્ટન્ટસ

સહકારી મંડળીઓ,

આણંદ

પેનલ-૩૦૮



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૦૩-૨૦૨૦ રકમ (રૂપિયા)	આવક	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૨,૯૪,૨૬,૩૭૭.૦૦	(૧) વ્યાજ અને વટાવ (અ) ધિરાણ પરનું વ્યાજ	૩,૧૯,૩૧,૨૮૯.૨૦	
૧,૬૩,૨૩,૬૫૪.૨૮	(બ) રોકાણ પરની આવક	૧,૬૫,૮૯,૭૪૩.૧૬	
૯૩,૩૬,૮૦૮.૦૦	(૧) બાંધી મુદતની થાપણ પર વ્યાજ	૯૯,૩૦,૮૯૮.૦૦	
૧૫,૧૨૩.૦૦	(૨) સરકારી જમીનગીરી પર વ્યાજ	૧૫,૧૨૩.૦૦	
	(૩) અન્ય વ્યાજ અને વટાવ		
૫,૫૧,૦૨,૦૬૩.૨૮			૫,૮૪,૬૭,૦૫૩.૩૬
૧,૭૪,૦૮૧.૩૪	(૨) કમીશન, એક્સચેન્જ અને દલાલી		૫૮,૮૪૧.૦૦
૧૦,૬૬,૮૦૩.૦૦	(૩) સેઈફ ડીપોઝીટ લોકર્સનું ભાડું		૧૩,૪૪,૬૦૬.૦૦
૭૭૨.૦૦	(૪) ડીવીડન્ડ		૦.૦૦
	(૫) અન્ય આવકો		
૭,૧૪,૯૫૩.૭૬	(૧) ઈન્સીડન્ટલ ચાર્જિસ	૫,૩૨,૪૬૫.૨૭	
૬,૦૮,૮૧૫.૦૦	(૨) સર્વિસ ચાર્જિસ એડવાન્સ	૪,૨૫,૪૨૫.૦૦	
૧,૮૮,૨૨૬.૦૦	(૩) વધારાની ઈન્કમ ટેક્સની જોગવાઈ પરત	૦.૦૦	
૦.૦૦	(૪) ગર્વમેન્ટ સીક્યુરીટી આવક (પાકતી મુદત)	૦.૦૦	
૬૭,૯૮૦.૬૬	(૫) એ.ટી.એમ. કાર્ડ ટ્રાન્ઝેક્શન ચાર્જિસ	૭૧,૩૭૩.૨૪	
૬૨,૧૦૦.૦૦	(૬) એ.ટી.એમ. વાર્ષિક ચાર્જિસ	૧,૦૪,૮૫૦.૦૦	
૧૬,૪૨,૦૭૫.૪૨			૧૧,૩૪,૧૧૩.૫૧
૫,૭૯,૮૫,૭૯૫.૦૪	કુલ ટોટલ		૬,૧૦,૦૪,૬૧૩.૮૭

નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

જતીનભાઈ જે. શાહ
ચેરમેન

ભુપેન્દ્રભાઈ બી પટેલ
વાઈસ ચેરમેન

કિરીટભાઈ જે. પટેલ
મેનેજિંગ ડીરેક્ટર

મયુર પટેલ
મનેજર



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું

૩૧-૦૩-૨૦૨૦	મુડી અને દેવું	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૨,૦૦,૦૦,૦૦૦.૦૦	(૧) ભંડોળ (અ) અધિકૃત શેર ભંડોળ ૮,૦૦,૦૦૦ શેર પ્રત્યેક રૂ.૨૫/-	૨,૦૦,૦૦,૦૦૦.૦૦	૨,૦૦,૦૦,૦૦૦.૦૦
૧,૩૩,૬૭,૧૨૫.૦૦	(બ) ભરપાઈ થયેલ અને વસૂલ આવેલ શેર ભંડોળ ૫,૪૩,૯૧૯/- શેર પ્રત્યેક રૂ.૨૫ નો.	૧,૩૬,૦૮,૪૭૫.૦૦	૧,૩૬,૦૮,૪૭૫.૦૦
૦.૦૦	(અ) વ્યક્તિઓ (બ) સોસાયટીઓ	૦.૦૦	
૧,૩૩,૬૭,૧૨૫.૦૦	(૨) રિઝર્વ ફંડ અને અન્ય રિઝર્વ		૧૩,૨૮,૨૭,૭૮૩.૦૨
૫,૮૨,૭૭,૮૮૨.૦૮	અનામત ભંડોળ	૬,૫૮,૦૮,૪૮૪.૫૮	
૨૪,૬૮,૨૬૦.૭૫	ડીવીડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ	૨૭,૨૮,૨૨૪.૭૫	
૨,૦૩,૨૧,૩૮૩.૧૩	બિલ્ડીંગ ફંડ	૨,૦૩,૨૧,૩૮૩.૧૩	
૨,૪૮,૪૦,૭૨૮.૬૧	બેંડ ડેબ્ટ્સ ફંડ	૨,૬૭,૮૨,૮૫૫.૬૧	
૧૨,૧૨,૮૨૧.૬૮	ધર્માદા ફંડ	૮,૫૭,૧૫૨.૬૮	
૦.૦૦	એજ્યુકેશન ફંડ	૨,૦૦,૦૦૦.૦૦	
૩૫,૮૧,૩૪૨.૨૫	સહકાર પ્રચાર ફંડ	૩૮,૧૫,૦૪૭.૨૫	
૨૮,૭૧૭.૦૦	સભાસદ પ્રોત્સાહન ફંડ	૧૩,૨૩,૫૩૫.૦૦	
૩૧,૬૬,૦૦૦.૦૦	સ્ટાન્ડર્ડ એસેટ્સ લોન સામે જોગવાઈ	૩૫,૬૬,૦૦૦.૦૦	
૩૮,૭૫,૦૦૦.૦૦	સ્પે.પ્રોવિઝન ફોર લોંગ ટર્મ ફાઈનાન્સ	૪૩,૨૫,૦૦૦.૦૦	
૨૫,૦૦,૦૦૦.૦૦	રોકાણ ઘસારાફંડ (ગર્વમેન્ટ સીક્યુરીટી)	૩૦,૦૦,૦૦૦.૦૦	
૧૨,૦૨,૮૩,૨૪૫.૫૨	(૩) ડીપોઝીટ અને અન્ય ખાતાઓ		૬૨,૬૩,૮૦,૦૮૭.૨૫
૨૨,૮૮,૦૬,૩૪૬.૦૦	(૧) ફીક્સ ડીપોઝીટ્સ (અ) વ્યક્તિઓ	૨૫,૩૨,૪૬,૫૪૮.૦૦	
૨૪,૫૦,૧૨,૩૮૦.૧૭	(૨) સેવીંગ્સ બેંક ડીપોઝીટ (અ) વ્યક્તિઓ (બ) અન્ય સોસાયટીઓ	૨૭,૮૮,૧૧,૧૦૮.૬૧	
૮,૮૦,૨૧,૭૩૬.૪૮	(૩) કરન્ટ ડીપોઝીટ (અ) વ્યક્તિઓ (બ) અન્ય સોસાયટીઓ	૮,૦૬,૨૩,૮૪૦.૬૪	
૩૮,૭૦,૨૮૨.૦૦	(૪) અન્ય-થાપણો (અ) રીકરીંગ બચત	૩૬,૦૮,૫૦૦.૦૦	
૫૭,૬૮,૧૦,૭૫૪.૬૬			
૭૧,૦૪,૬૧,૧૨૫.૧૮	સરવાળો આગળ લઈ ગયા		૭૭,૨૮,૨૭,૩૫૫.૨૭



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું

૩૧-૦૩-૨૦૨૦	મિલ્કત અને લેણાં	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૩૫,૭૦,૫૮૮.૦૦	(૧) હાથ ઉપરની રોકડ		૩૪,૭૮,૭૪૫.૦૦
૪,૧૯,૯૪,૫૨૫.૧૪	(૨) રિઝર્વ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ કો.ઓ.બેંક અને સેન્ટ્રલ કો.ઓ. બેંક વગેરે બેંકોમાં સિલક	૩,૧૩,૫૧,૭૬૬.૭૨	
૨૨,૯૭,૭૪,૦૫૮.૦૦	(અ) કરન્ટ ડીપોઝીટ (બ) ફીક્સ ડીપોઝીટ	૨૭,૧૮,૯૦,૯૬૩.૦૦	
૨૭,૧૭,૬૮,૫૮૩.૧૪	(૩) રોકાણો		૩૦,૩૨,૪૨,૭૨૯.૭૨
૫,૦૦૦.૦૦	ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી.શેર	૫,૦૦૦.૦૦	
૧૦૦.૦૦	ભ.ડી.સે.કો.બેંક લી.શેર લી. શેર	૧૦૦.૦૦	
૧૩,૩૫,૬૫,૨૫૦.૦૦	ગર્વમેન્ટ સીક્યુરીટી	૧૩,૩૫,૬૫,૨૫૦.૦૦	
૧૩,૩૫,૭૦,૩૫૦.૦૦	(૪) ધીરાણો		૧૩,૩૫,૭૦,૩૫૦.૦૦
	(અ) ટૂંકી મુદતની લોન કેશક્રેડીટ		
૬,૨૮,૦૦,૦૯૧.૩૧	ઓવર ડ્રાફ્ટ અને બીલ્સ -ડીસ્કાઉન્ટ		
	(૧) વ્યક્તિઓ પાસે	૯,૧૬,૨૫,૪૮૬.૮૬	
૨૫,૦૯,૨૬,૬૦૭.૯૪	(બ) મધ્યમ મુદતની લોન		
	(૧) વ્યક્તિઓ પાસે	૨૬,૦૮,૮૫,૫૮૦.૫૪	
૩૧,૩૭,૨૬,૬૯૯.૨૫	(૫) મળવાપાત્ર વ્યાજ		૩૫,૨૫,૧૧,૦૬૭.૪૦
૫૦,૫૯,૦૧૬.૦૦	મળવાપાત્ર વ્યાજ ફિક્સ ડીપોઝીટ	૪૧,૬૩,૭૮૪.૦૦	
૩૧,૧૮,૮૯૦.૦૦	મુદત વિતિ વ્યાજ (એન.પી.એ.)	૪૧,૧૩,૯૯૦.૦૦	
૧૭,૩૦,૬૭૪.૦૦	મળવા પાત્ર વ્યાજ ગર્વમેન્ટ સીક્યુરીટી	૧૭,૩૦,૬૭૨.૦૦	
૯૯,૦૮,૫૮૦.૦૦	(૬) બિલ્સ રીસીવેબલ સામી બાબુ		૧,૦૦,૦૮,૪૪૬.૦૦
૦.૦૦	(સામે બતાવ્યા મુજબ)		૦.૦૦
૮૩,૩૮,૫૧૪.૬૮	(૭) ફીક્સ એસ્ટ્સ	૭૫,૮૫,૬૩૭.૬૮	
૩૬,૯૩૦.૦૦	(વર્ષ દરમિયાન ઉમેરો)	૬,૪૫,૪૫૪.૮૦	
૭,૮૯,૮૦૭.૦૦	બાદ-ઘસારો	૫,૬૧,૩૦૩.૦૦	
૭૫,૮૫,૬૩૭.૬૮			૭૬,૬૯,૭૮૯.૪૮
૭૪,૦૧,૩૦,૪૩૮.૦૭	સરવાળો આગળ લઈ ગયા		૮૧,૦૪,૭૯,૧૨૭.૬૦



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું

૩૧-૦૩-૨૦૨૦	મુડી અને દેવું	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૭૧,૦૪,૬૧,૧૨૫.૧૮	સરવાળો આગળ લાવ્યા		૭૭,૨૮,૨૭,૩૫૫.૨૭
૦.૦૦	(૪) બિલ્સ ફોર કલેક્શન	૦	૦.૦૦
૩૧,૧૮,૮૮૦.૦૦	સામી બાજુ બિલ્સ રીસીવેબલ પ્રમાણે		૪૧,૧૩,૮૮૦.૦૦
૧,૨૧,૫૮,૪૮૫.૦૦	(૫) મુદતવિતિ વ્યાજ સામે અનામત (એન.પી.એ. વ્યાજ)		૧,૫૧,૦૩,૦૨૧.૦૦
૭,૭૬,૭૬૧.૦૦	(૬) ચુકવવા પાત્ર વ્યાજ	૨૦,૪૧,૧૭૧.૦૦	
૩,૨૮,૫૨૫.૦૦	(૭) અન્ય જવાબદારીઓ	૧,૮૦,૭૫૫.૦૦	
૨,૭૨,૫૩૨.૦૦	(૧) અનપેઈડ ડીવીડન્ડ	૬,૩૩,૨૬૭.૦૦	
૩,૨૮,૮૨૫.૮૮	(૨) પ્રોવીઝન પેએબલ	૩,૭૦,૭૬૨.૭૮	
૬૬,૦૦,૦૦૦.૦૦	(૩) બેંકર્સ ચેક પેએબલ	૫૧,૦૦,૦૦૦.૦૦	
૧,૮૪,૬૮૦.૦૦	(૪) ટીડીએસ, જીએસટી, પીએફ, પ્રો. ટેક્સ પેએબલ	૧,૮૪,૬૮૦.૦૦	
૮૪,૮૨,૪૨૩.૮૮	(૫) ઈન્કમ ટેક્સ ની જોગવાઈ		૮૫,૧૦,૬૩૫.૭૮
૦.૦૦	(૬) પ્રોવીઝન ફોર એડવાન્સ પેમેન્ટ		૦.૦૦
૧,૨૫,૮૦,૬૯૧.૮૦	(૮) બેંક ગેરેન્ટી (સામે બતાવ્યા પ્રમાણે)	૧,૨૮,૪૮,૧૮૨.૫૦	
૧,૨૫,૮૦,૬૯૧.૮૦	(૯) નફા નુકશાન ખાતું	૧,૨૮,૪૮,૧૮૨.૫૦	
૧,૨૮,૪૮,૧૮૨.૫૦	પાછલા વર્ષનો નફો		૧,૫૮,૬૪,૬૫૮.૦૮
	બાદ : ફાળવણી		
	ચાલુ સાલનો ચોખ્ખો નફો		
	(નફા નુકશાન ખાતેથી લાવ્યા)		
૭૪,૭૧,૭૮,૧૦૬.૬૬	કુલ સરવાળો		૮૧,૬૫,૧૮,૬૬૧.૧૪

નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

અમારા ઓડિટ રીપોર્ટને આધિન

સ્થળ : અંકલેશ્વર

તારીખ : ૨૮/૦૬/૨૦૨૧

UDIN:21157524AAAABI2829

સહી :-

HIRAL PRAJAPATI & CO.

ચાર્ટડ એકાઉન્ટન્ટસ

સહકારી મંડળીઓ,

આણંદ

પેનલ-૩૦૮



તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું

૩૧-૦૩-૨૦૨૦	મિલ્કત અને લેણાં	રકમ (રૂપિયા)	૩૧-૦૩-૨૦૨૧ રકમ (રૂપિયા)
૭૪,૦૧,૩૦,૪૩૮.૦૦	સરવાળો આગળ લાવ્યા		૮૧,૦૪,૭૯,૧૨૭.૬૦
	(૮) અન્ય અસ્કયામતો :		
૫૪,૫૩૫.૦૧	(૧) ટેલીફોન, જી.ઈ.બી., વોટર ડીપોઝીટ	૫૪,૫૩૫.૦૧	
૪૬,૪૮૫.૦૦	(૨) સ્ટેશનરી સ્ટોક	૧૭,૮૭૦.૦૦	
૬૦૦.૦૦	(૩) અધેસીવ સ્ટેમ્પ	૧૫૦૦.૦૦	
૧,૧૮,૭૭૮.૬૭	(૪) ટી.ડી.એસ., જીએસટી રીસીવેબલ	૪,૧૪,૬૭૪.૭૪	
૧,૮૯,૦૪૦.૦૦	(૫) જી.ઈ.બી. બીલ્સ કલેક્શન ડીપોઝીટ	૧,૮૯,૦૪૦.૦૦	
૬૦,૦૦,૦૦૦.૦૦	(૬) એડવાન્સ ઈન્કમ ટેક્સ	૪૭,૦૦,૦૦૦.૦૦	
૩,૮૯,૮૦૪.૦૦	(૭) મળવાપાત્ર આઈ.ટી રીફંડ	૭૪,૫૪૮.૦૦	
૨૯,૫૭૧.૨૩	(૮) ડી ઈ એ એફ આર.બી.આઈ	૨૯,૫૭૧.૨૩	
૨૮,૭૮૦.૦૦	(૯) એડવાન્સ ફોર કોમ્પ્યુટર સોફ્ટવેર	૨૮,૭૮૦.૦૦	
૧,૮૪,૬૮૦.૦૦	(૧૦) એડવાન્સ ફોર એટીએમ કાર્ડ	૧,૮૪,૬૮૦.૦૦	
૬,૨૯૪.૬૮	(૧૧) મળવાપાત્ર કમીશન ગુજરાત ગેસ અને જીઈબી	૧૧,૧૬૭.૫૬	
૦.૦૦	(૧૨) એક્સ ગ્રેશીયા પેમેન્ટ સીસીવેબલ	૩,૩૪,૧૬૭.૦૦	
૭૦,૪૮,૬૬૮.૫૯			૬૦,૪૦,૫૩૩.૫૪
૦.૦૦	(૯) બેંક ગેરેન્ટી-સામે બતાવ્યા મુજબ		૦.૦૦
૭૪,૭૧,૭૯,૧૦૬.૬૬	કુલ સરવાળો		૮૧,૬૫,૧૯,૬૬૧.૧૪

નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેંક લી.

જતીનભાઈ જે. શાહ
ચેરમેન

ભુપેન્દ્રભાઈ બી પટેલ
વાઈસ ચેરમેન

કિરીટભાઈ જે. પટેલ
મેનેજિંગ ડીરેક્ટર

મયુર પટેલ
મનેજર



સ્વતંત્ર અન્વેષણ અહેવાલ
HIRAL PRAJAPATI & Co.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પેનલ નં. ૩૦૮, આણંદ



પ્રતિ,
સભાસદશ્રી તમામ,
નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપ. બેંક લી.,
જી.આઈ.ડી.સી.,
અંકલેશ્વર

આપની બેંકના હિસાબી વર્ષ ૨૦૨૦-૨૧ના સ્ટેચ્યુટરી ઓડીટર તરીકે અમારી નિમણુંક સંયુક્ત રજીસ્ટ્રાર (ઓડીટ), સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, તા: ૦૮/૦૭/૨૦૨૦ ના પત્ર ક્રમાંક જા.નં. અષણ/૨૪૬૦/જ-૪/૩૪૬/૨૦૨૦ થી નિમણુંક કરવામાં આવેલ છે. અમોએ અમારી ઓડીટ કામગીરી બેંક દ્વારા વખતોવખત પુરી પાડવામાં આવેલ માહિતીના આધારે પૂર્ણ કરેલ છે. આ સંસ્થાનું પાકું સરવૈયું, નફા-નુકશાન પત્રક તથા હિસાબી દફતરની ચકાસણી કરી નીચે મુજબ અહેવાલ રજુ કરીએ છીએ.

હિસાબી દફતરની ચકાસણી કરી નીચે મુજબ અહેવાલ રજુ કરીએ છીએ.

- (૧) બેંક વ્યવસ્થાપક સમિતી દ્વારા બેંકનો વહીવટ સહકારી મંડળીના કાયદાની જોગવાઈઓ અને પેટા નિયમોને આધીન રહીને ચલાવવામાં આવે છે અને કાયદા-કાનુનની જોગવાઈઓનું સમિતી દ્વારા પાલન થાય છે.
- (૨) બેંક વ્યવસ્થાપક સમિતી દ્વારા આર.બી.આઈ.ના વખતોવખત નાં સરકયુલર અને માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવામાં આવે છે.
- (૩) બેંકના હિસાબી દફતર તથા વાર્ષિક હિસાબી પદ્ધતિ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચના અને સહકારી મંડળીના કાયદાની જોગવાઈ અનુસાર નિભાવવામાં આવેલ છે.
- (૪) બેંકના હિસાબો અંગે અપનાવવામાં આવેલી પદ્ધતિઓ તથા અન્ય નોંધો (નોટ્સ ઓન એકાઉન્ટસ) તથા સામાન્ય શેરો ને આધીન બેંકનું સરવૈયું બેંકની આર્થિક સ્થિતિનું વાસ્તવિક ચિત્ર દર્શાવે છે. તા : ૩૧/૦૩/૨૦૨૧ના રોજના સરવૈયામાં દર્શાવેલ મુડી-દેવા મિલ્કત-લેણાંની પરિસ્થિતિ વાસ્તવિક અને ખરી છે, તેમજ તા:૩૧/૦૩/૨૦૨૧ ના રોજ પુરા થતા નફા-નુકશાન ખાતામાં દર્શાવેલ નફો સાચો તથા વ્યાજબી છે.
- (૫) બેંક દ્વારા આર.બી.આઈ.ની એન.પી.એ. અંગેની ગાઈડ લાઇન્સ મુજબ મિલકતોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. અને તે અંગે પર્યાપ્ત જોગવાઈ કરવામાં આવેલ છે.



- (૬) બેંકના જણાવ્યા પ્રમાણે વ્યવસ્થાપક મંડળના સભ્યોને અને તેમનાં કુટુંબીજનોને કોઈપણ પ્રકારનું ધિરાણ કરવામાં આવેલ નથી.
- (૭) બેંકના હોદ્દાઓ કે ડીરેક્ટર્સશ્રી દ્વારા સહકારી કાયદા-કાનુન કે પેટાનિયમોની જોગવાઈ મુજબ ગેરલાયકાત વ્હોરેલ નથી.
- (૮) બેંક દ્વારા ઓડીટ દરમિયાન વનટાઈમ સેટલમેન્ટ કે ડીપોઝીટ સેટ ઓફ કરેલ નથી.
- (૯) હિસાબી વર્ષ દરમિયાન લેણાં માંડવાળ કરેલ નથી.
- (૧૦) બેંક દ્વારા અન્ય કો-ઓપરેટીવ બેંકોમાં થાપણો મુકવામાં આવેલ નથી.
- (૧૧) બેંકે ડીફર્ડ ટેક્સ લાયબીલીટી ની જોગવાઈ કરેલ નથી.
- (૧૨) કોર્ટ રાહે સમાધાન માંડવાળના કિસ્સાઓમાં સંસ્થાનું નાણાંકીય હિત જોખમાયેલ નથી.

તારીખ : ૨૮/૦૬/૨૦૨૧

સ્થળ :આનંદ

UDIN : 21157524AAAABI2829

સહી/-

CA Hiral Prajapati & Co.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

સહકારી મંડળીઓ, આણંદ

પેનલ-૩૦૮



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



NAVSARJAN INDUSTRIAL CO-OP. BANK LTD ANKLESHWAR 2020-21

Notes forming part of the Balance Sheet as at 31st March, 2021 and Profit and Loss Account for the year ended 31st March 2021.

1. Basis Of Accounting

The financial statements have been drawn up on historical cost convention ; going concern basis and on accrual basis of accounting (Unless otherwise stated) system and confirm to the statutory provision and mandatory accounting standards issued by the Institute of Chartered Accountants of India and practices followed in the Banking Industry in Co-Operative Banking Sector. The accounting policies adopted in the preparation of the financial statements are consistent with those followed in the previous.

2. Use Of Estimates:

The preparation of the financial statements, in conformity with Ind AS requires management to make judgments, estimates and assumptions that affect the application of accounting policies and reported amounts of assets, liabilities, income and expenditures and disclosure of contingent liabilities at the date of the financial statement. Actual results could differ from those estimates. Management believes that the estimates used in the preparation of the financial statement are prudent and reasonable. Any revision to the accounting estimates are recognized prospectively.

A) SIGNIFICANT ACCOUNTING POLICIES:

1. Advances:

- (A) Advances are classified as Standard, Sub-Standard, Doubtful, or Loss Assets, and provision required for possible losses on such advances are made as per the guidelines of the Reserve Bank of India on matters relating to prudential norms. We observed few cases where prudence norms are not followed. The details are mentioned herewith.
- (B) The overdue interest in respect of non – performing advances is provided separately under “Overdue Interest Reserve Fund ” GL Code 006908 -- Rs. 41,13,990/- as per the directives issued by RBI and this interest is not recognized as income of current year, it will be recognized income in the year in which it will realized in cash. Please refer our other observation and finding for below mentioned accounts.

Sr. No's	Audit observations	Amount	Effect in current year Balance sheet / Profit Loss Account
1	Audhoot Enterprise Hypothication Loan 000418. This account has 6 EMI Over due. The above account was not classified as NPA. We are of opinion that it has to be	Rs. 10,82,231/- this amount to transfer in NPA Account. This amount includes overdue interest	Over stated in Advances balance Rs. 10,82,231/- and over stated interest income of Rs. 20,732 and



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



classified as NPA and consider in Sub-standard accounts.	of Rs. 20,732 and incidental charges of Rs.354/-	incidental charges of Rs 354/-
Audhoot Enterprise Cash Credit Loan 000135. This account has Excess overdue. The above account was not classified as NPA. We are of opinion that it has to be classified as NPA and consider in Sub-standard accounts.	Rs.38,55,777.37/- this amount to transfer in NPA Account. This amount includes overdue interest of Rs. 1,35,345 /-	Over stated in Advances balance Rs. 38,55,777.37/- and over stated interest income of Rs. 1,35,345/-

(c) Bank's total deposit is Rs.62,63,90,097 as on 31st March 2021 . Whereas in Advances bank has given Rs.35,25,11,067 only which is 56.28 % of total deposit. As result of this analysis we recommended that Bank should focus more on core banking activity for lending.

2. Investments

Investments are classified in the category i.e. **Held to Maturity** and Current Investments. Investments in Govt. Securities are classified under **held to maturity** category and are valued at face value. In case of Govt Securities purchase at premium it is valued at Face value and Premium paid on the purchase of security was treated as current year expense and the same premium is charged to profit and loss account instead of treating the premium paid as deferred asset and amortize the same amount of premium paid over the remaining life of the security.

Investment Held to Maturity	Rs. 1341.32 Lakh
Book Value of Investment	Rs. 1335.65 Lakh
Face value of investment	Rs. 1360.00 Lakh
Market value of Investment	Rs. 1432.56 Lakh

3. Fixed Assets:

- All the tangible fixed Assets have been stated at cost comprises the purchase price and attributable cost of bringing the assets to its working condition for its intended.
- The carrying amounts are reviewed at each Balance-Sheet date to access whether they are recorded in excess of their recoverable amounts and where carrying values exceed this estimated recoverable amount, assets are written down to their recoverable amount.
- Fixed assets held for disposal have been stated at the lower of cost or net realizable value and shown separately in the financial statements. Any expected loss is recognized immediately in the profit and loss statement.
- The fixed assets are stated at cost of acquisition less accumulated depreciation. Depreciation is recognized on Written down Value and as per rates of Income Tax Act, 1961 depreciation entry will be provided at the year end.



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



4. **Impairment of Assets:** A substantial portion of the bank's assets comprise of "Financial Assets" to which Accounting standard-28 on Impairment of assets issued by the Institute of Chartered Accountants of India, is not applicable. In the opinion of the bank the fixed assets possessed by the Bank are in the nature of "Corporate Assets" and are not Cash Generating Units as defined by the said Accounting Standard and there is no impairment of any of the fixed assets.

5. **Recognition of Income and Expenditure:**

- Items of income and expenditure are accounted for on accrual basis. However, considering the nature of transactions, uncertainties involved and consistent practice, Commission, Brokerage, locker rent, guarantee commission, dividend and exchange and interest and income on Non Performing Assets are recognized on cash basis.
- Interest on loan and advances is recognized on accrual basis other than on those stipulated in RBI's prudential norms on income recognition, asset classification and provision relating to NPA, where the income is recognized on realization.
- Dividend is recognized as and when declared by the investee companies and the right to receive same has been established.
- In case of Govt Securities purchase at premium it is valued at Face value and Premium paid on the purchase of security was treated as current year expense and the same premium is charged to profit and loss account instead of treating the premium paid as deferred asset and amortize the same amount of premium paid over the remaining life of the security.
- Taxation Provision for current income tax will determined in accordance with the provision of Income Tax Act, 1961 and will make annually based on tax liability computed after considering the allowances and exemptions.

6. **Earning per share:**

Basic Earnings per share is not disclose as it is not considered required for co-operative society and also shares are not listed with any stock exchange in india.

7. **Segment Reporting:**

Except the banking segment the Bank does not have any other operation segment. The risk and returns of the bank are affected predominantly by banking operations only which can be classified as primary segment. The results of the segment are self explanatory from the profit and loss statement.

8. **Employee Benefits:**

Retirement benefits are provided for in the books on the accrual basis in the following manner.

- Provident Fund:** Employee gets benefit from provident fund, which is a defined benefit plan. The employer and employee each make periodical contribution to the plan. The contributions are deposited with EPFO office.
- Gratuity Fund:** The bank has created Group Gratuity Fund with Life insurance Corporation of India. The Premium has been charged to Profit and loss Account.
- Leave pay:** Liability for leave pay is provided at the end of the year and required payments will be made subsequently.

9. **Related Party Disclosure.**

There are related party disclosures made and details regarding related parties have been maintained by the Bank. No such advances given to related party.



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



10. Leases:

Since the bank has no premises on lease hence AS-19 for operating lease is not applicable.

11. Provisions, Contingent liabilities and contingent assets:

A provision is recognized when the bank has a present obligation as a result of past event where it is probable that an outflow of resources will be required to settle the obligation, in respect of which a reliable estimate can be made. Provisions are not discounted to its present value and are determined based on best estimate required to settle the obligation at the balance sheet date. These are reviewed at each Balance Sheet date and adjusted to reflect the current best estimates.

When there is a possible or a present obligation in respect of which the likelihood of outflow of resources is remote, no provision or disclosure is made.

Contingent assets are not recognized in the financial statements. However, contingent assets are assessed continually and if it is virtually certain that an inflow of economic benefits will arise, the asset and related income are recognized in the period in which the change occurs.

12. Advances against housing sector Rs. 633.70 Lakh and Advances against Shares and debenture is NIL

13. NPA Accounts :

1	Gross NPAs as per bank	30.27
2	Net NPAs	0%
3	Percentage of Gross NPAs to Total Advances	0.86%
4	Percentage of Net NPAs to Total Advances	0%

14. Movements in NPAS Accounts

1	Total NPA as on 31/03/2020	30.27
2	Less: Reduction in NPA Recovery , Up gradation and Compromise / Settlement	0
3	Add: New NPA during the year	
4	Total NPA as on 31/03/2021	30.27
There are two accounts(HYP and CC) which are NPA at the year end having outstanding Amount to Rs. 49.38 Lakh. The overdue period is 6 (six) and more months with overdue amount of Rs.8.69but bank has not classify them as substandard NPA accounts. No substandard provision provided and interest income has been recognised on this substandard NPA NPA accounts.		



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



15.	Profitability	
1	Interest as a percentage of Working Funds	7.20%
2	Non - Interest as a percentage of Working Funds	0.31%
3	Operating Profit as a percentage Of working Funds	2.46%
4	Business (Deposit + Advances) Per Employee	Rs. 652.60 Lakh
5	Profit per employee	Rs. 8.63 Lakh

16.	PROVISION	Rs . In Lakh
1	Provision on NPAS required to be made	79.65
	Provision actually made	267.82
2	Provisions required to be made in respect of overdue interest taken into account	0
	Provisions actually made in required to be made in respect of overdue interest taken into income account	0
3	Provision required to be made - Gratuity Fund	0
	Provision actually made - Gratuity Fund	0
4	Provision required to be made - Provident Fund	0
	Provision actually made - Provident Fund	0
5	Provision required to be made - for arrears of Reco for Inter branch Accounts.	0
	Provision actually made - for arrears of Reco for inter branch accounts	0
6	Provision required to be made - on depreciation of Investment	0
	Provision actually made - on depreciation of Investment	30.00

Movement in Provision account	Rs . In Lakh
--------------------------------------	-------------------------



HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



17.	Particular	Opening Balance	Addition during the year	Reduction During the year	Balance at the year end
1	NPA s	248.40	19.42	-	267.82
2	Over Due Interest on NPA	31.18	41.14	-	72.32
3	Depreciation in Investment Account	25.00	5.00	-	30.00
4	Standard assets Contingent Reserve	31.66	4.00	-	35.66

18. Capital to risk weighted assets ratio (CRAR) Is 32.79 %. At the beginning of the financial year CRAR was 33.44 %.

19. Payment to DICGI Insurance payments.
The bank has made regular payments of insurance premium to deposit insurance and credit guarantee corporation during the year. These payments are on half yearly basis and copy of receipts is also kept on records of such premium payments.

Period	Premium Amounts	Payment Date
01/04/2020 - 30/09/2020	Rs.4,17,183.34	22/05/2020
01/10/2020 - 31/03/2021	Rs.4,30,595.69	25/11/2020

20. **Unclaimed Dividend** :During the financial year unclaimed dividend amount to Rs.2,35,258/- for F.Y.2016-17 has been transfer to reserve fund, as dividend has not been claimed by the share holders.

B: Additional information to the Financial Statements.

1. **Contingent Liabilities**

The contingent liability has been assessed at the end of the year on 31/03/2021.

2. In the opinion of the board; the current assets, loans and advances are approximately of the value stated if realized in the ordinary course of business. The provisions for all known liabilities will be made at the end of the year.

3. **DEPRECIATION:**

Depreciation has been charged in the Profit and Loss account at the rate defined in income tax act.

C: Disclosure under Accounting Standards as notified under the Companies (Accounting Standard) Rules, 2006

1. Employee's Benefits

i) **Defined Contribution Plan**

Bank has made contribution to Provident Fund as per the provisions of the EPF Act.

ii) **Defined Gratuity Benefit Plan**

a) The bank has contributed the amount of premium towards the Gratuity Policy with the LIC for the eligible employees under the act.



નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ
કો-ઓપરેટીવ બેંક લી.



Annual
Report-2021

HIRAL PRAJAPATI & Co
Chartered Accountants



D : DEFERRED TAX

Differed tax liability as per AS-22 has not been provided by the bank.

E : Compliance with IRAC (Income Recognition and Assets classification) : Bank has not complied with IRAC norm of RBI and details has been provided in para 1 of Advances in this report.

FOR HIRAL PRAJAPATI & CO
Chartered Accountants
FRN 139094W
Co-Op Reg : 308

CA HIRAL PRAJAPATI
Partner
M. Nos. 157524
UDIN: 21157524AAAABI2829

Place: Anand
Dated: 28.06.2021



સભાસદશ્રીઓ તથા ખાતેદારોએ ધ્યાનમાં રાખવાની જરૂરી વિગતો

- (૧) આપનું સરનામું બદલાયું હોય તો તાત્કાલીક બેંકને નવા સરનામાની જાણ કરો અને જે ખાતેદારોના ઓળખના પુરાવા એટલે **K.Y.C.** ના ડોક્યુમેન્ટ્સ બેંકમાં જમા કરાવ્યા ન હોય તો તાત્કાલિક જમા કરાવવા વિનંતી.
- (૨) જેઓ પોતાના શેર સર્ટિફિકેટ લઈ ગયા નથી, તેઓએ પોતાના પાસપોર્ટ સાઈઝના ૨ નંગ ફોટોગ્રાફ આપી શેર સર્ટિફિકેટ મેળવી લેવા.
- (૩) સહકારી કાયદા અન્વયે વારસ નિમાવાનું ફરજિયાત છે. જે સભાસદો તથા ખાતેદારોએ પોતાના વારસદારની નિમણુંક કરાવી નથી તેઓ વહેલી તકે કરાવી લેવી.
- (૪) જામીન થનાર સભાસદોએ સમજવું જરૂરી છે કે, કરજદારે લીધેલ કરજની રકમ અને વ્યાજની રકમ માટે સંપૂર્ણપણે તેઓ જવાબદાર છે, નહીં કે ફાળે પડતી રકમ માટે.
- (૫) કરજ લેતાં સભાસદોને તેમની સવલત ખાતર તેમણે લીધેલ કરજના હપ્તાની પાકતી મુદતની ખબર આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ખબર આપવી બેંક માટે ફરજિયાત નથી અને આવી ખબર કરજદાર અગર જામીનદારને મળીના હોય તો તે માટે બેંક જવાબદાર નથી.
- (૬) કરજ અરજીઓની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઝીણવટભરી છણાવટ કરે છે અને કરજદારની પરત કરવાની નાણાંકીય શક્તિ છે કે નહીં, આવક અંગેના પુરા સાધનો, કર્જ કરવાનું કારણ, તેમની આર્થિક પરિસ્થિતિ, તેમના જામીનો અને બજારમાં નાણાંકીય વ્યવહાર વગેરે ધ્યાનમાં લઈને ધિરાણ મંજૂર કરવામાં આવે છે. તો તે માટે બેંકને જરૂરી માહિતી બરાબર પુરી પાડવી.
- (૭) તમામ કેશ-ક્રેડીટ લીમીટની મુદત એક વર્ષની હોય છે. મુદત પુરી થાય તે પહેલાં એક માસ અગાઉ લીમીટ રીન્યુઅલ અરજી માહિતી મોકલી આપવી.
- (૮) સભાસદોને જાણ કરવામાં આવે છે કે શેર ડિવિડન્ડની રકમ તેઓના સેવિંગ્સ ખાતામાં જમા કરવામાં આવશે, જેઓના ખાતા ન હોય તેઓએ ખાતા ખોલાવી લેવા. બેંકના પેટા નિયમ ૪૯ (૪) અન્વયે ત્રણ વર્ષ પહેલાંના ડિવિડન્ડની બાકી રકમ રીઝર્વ ખાતે લઈ જવામાં આવે છે ની નોંધ લેશો.
- (૯) બેંક તરફથી આપનું કાર્ય ઝડપથી પતાવવામાં આવે છે તેમ છતાં આપના કામની સગવડતા રહે અને જલ્દી ઉકેલ લાવી શકાય તે માટે જે સહકાર આપો છો તેવો જ સહકાર કર્મચારીઓ સાથે પણ ચાલુ રાખશો તેવી વિનંતી છે.
- (૧૦) ધિરાણ લેનાર સભાસદોના ધિરાણ ખાતામાં પ્રત્યેક માસ આખરે વ્યાજ ઉધારવામાં આવે છે તો તે વ્યાજ બીજા માસની ૧૦મી તારીખ પહેલા જમા કરાવી જવું.
- (૧૧) સભાસદોએ તેમના ડિવિડન્ડ તાકીદે વટાવી લેવા તેમજ અગાઉના વર્ષનું ડિવિડન્ડ ન મળેલ હોય તો તે બેંકમાં પોતાનું ઓળખકાર્ડ રજુ કરી મેળવી લેવું.
- (૧૨) બેંકના ખાતેદારોએ ખાતામાં **Email ID** રજીસ્ટર્ડ કરાવવા જેથી માસિક અને વાર્ષિક એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવી શકાય.



વ્યાજમાંથી આવકવેરા (TDS) કપાત બાબતે થાપણદારોને ખાસ સૂચના

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રજુ થયેલ કેન્દ્રીય બજેટ મુજબ રીકરીંગ ડીપોઝીટ સહીતની ટર્મ ડીપોઝીટનું વ્યાજ બેંકની શાખાઓ સહીત વાર્ષિક રૂ. ૪૦,૦૦૦/- થી વધુ હોય તો તા. ૧-૪-૨૦૧૯ અમલમાં આવે તે મુજબ TDS કપાત કરવામાં આવે છે.

- ❖ ખાતેદાર જે તે નાણાંકીય વર્ષ માટે 15G/15H ફોર્મ આપે તો તે વર્ષમાં TDS કપાશે નહીં. દર વર્ષે એપ્રિલ માસમાં 15G/15H ફોર્મ નવુ આપવાનું રહેશે. (TDS ના નિયમને આધીન)
- ❖ જો ખાતેદારે / સભાસદે બેંકમાં PAN Card જમા કરાવ્યો હોય તો ૧૦% મુજબ TDS કપાશે.
- ❖ જો ખાતેદારે / સભાસદે બેંકમાં PAN Card જમા કરાવ્યો ન હોય તો ૨૦% મુજબ TDS કપાશે.
- ❖ જો ખાતેદારે / સભાસદે ઇન્કમ ટેક્સ ઓથોરીટી પાસેથી TDS કપાત ન કરવા સર્ટીફિકેટ રજુ કરે તેમની TDS કપાત કરવામાં આવશે નહીં.
- ❖ બેંકના સભાસદ કે નોમીનલ મેમ્બરની ટર્મ ડીપોઝીટ / રીકરીંગ ડીપોઝીટ પર TDS કપાતને પાત્ર રહેશે.
- ❖ તા. ૦૧-૦૪-૨૦૧૮ થી સીનીયર સીટીઝન માટે TDS મુક્ત વ્યાજની લીમીટ રૂ. ૫૦,૦૦૦/- થયેલ છે.